

નાડોલના લેખો.

ગોડવાડ પ્રાંતમાં નાડોલ પણુ એક પ્રસિદ્ધ સ્થાન ગણ્યાય છે અને મારવાડનાં પંચતીર્થીમાંતું તે એક તીર્થ સ્થાન મનાય છે. જૂના સમયમાં તે ચૈંડાણ્ણોનું પાટનગર હતું. એ ગામમાં પદ્મ પ્રલુના નામનું એક મંદિર ધર્ઘણુંજ વિશાળ, લંઘ અને જોવા લાયક છે.

(૩૬૪-૬૫)

એ મંદિરના ગૂઢમંડપમાં બે ભાજુઓ નેમિનાથ અને શાંતિનાથની કાયોત્ત્સર્ગસ્થ એ પ્રતિમાઓ છે તેમના ઉપર આ લેખો કેાતરેલા છે. લેખોની મિતિ સં. ૧૨૧૫ વૈશાખ શુહિ ૧૦ લૌભવારની છે. વીસાડા

33

૬૬૭

નામના સ્થાનમાં આવેલા મહાવીર દેવના ચૈત્યમાં, હેમહાજ, ધરણી, જસચંદ્ર, જસદેવ, જસધવલ અને જસપાલ નામના શ્રાવકોએ આ પ્રતિમાઓ અનાવીને બૃહુદ્ગચ્છના આચાર્ય સુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય, દેવસૂરિના શિષ્ય પદ્મચંદ્ર ગણિના હુણે પ્રતિષ્ઠિત કરાવી, એમ આ દેખનો ભાવાર્થ છે. આ દેખમાં પતિષ્ઠાતાના નામ સાથે ‘પાણીની’ શાખ લગાડવામાં આવ્યો છે તેથી જણ્ણાય છે કે-તેઓ પાણીની રચિત વ્યાકરણ શાસ્ત્રના મહાટા અભ્યાસી હશે. મૂળ આ પ્રતિમાઓ વીસાડા નામના સ્થાનમાં એસાડેલી હતી એમ દેખ કરે છે તેથી જણ્ણાય છે કે પાછળથી કોઈ વખતે આ મંદિરમાં તેમને આણુવામાં આવી છે.

(૩૬૬-૩૭)

આ અંને દેખો, એજ મંદિરના મૂળ ગભારામાં સુખ્ય વેદિ ઉપર ને ત્રણ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે તેમાંની ઐ ઉપર કોતરેલા જોવામાં આવે છે. ૩૬૭ નંખર વાળો દેખ, મધ્યસ્થાને વિરાજિત મૂલ નાયક પદ્મપ્રભુની પ્રતિમા ઉપરનો છે. દેખોક્તા હુક્કિકત આ પ્રમાણે છે:-

સં. ૧૬૮૬ ના પ્રથમ આષાઢ માસની વર્ષી ૫ શુક્રવારના દિવસે, મહારાજાધિરાજ ગજસિંહનો રાજ્ય કરારભાર ચલાવનાર મંત્રી જ્યમદ્વાળુએ આ પ્રતિમાઓ અનાવી અને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના ગાદ્ધીધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય અને જહંગીર બાદશાહે જેમને ‘મહાતપા’ હું બિદ્રૂદ આયું હતું, તે શ્રી વિજયદેવસૂરિએ, પેતાના પદ્મધર આચાર્ય વિજયસિંહ આદિ શિષ્ય પરિવાર સાથે, તે મૂર્તિએની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કાર્ય જલોરમાં થયું હતું. ત્યાંથી એ મૂર્તિએ લાવીને નાડોલના આ રથ-વિહાર નામના મંદિરમાં, રાણું જગતસિંહજીના રાજ્ય વખતે સ્થાપન કરવામાં આવી.

ગોડવાડ પ્રાંત કે જેમાં આ નાડોલ, નાડોલાઠ વિગેરે નૈનતીર્થ સ્થાનો આવેલાં છે તે, પહેલાં મેવાડ રાજ્યના તાણામાં હતો અને

તેથીજ આ લેખામાં મેવાડના રાણુ જગતસિંહના રાજ્યનું નામ ચાપવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા કરાવનાર મં. જયમદલજી મારવાડ રાજ્યનો મંત્રી અને જેધપુરનો રહેવાસી હતો. હાલમાં તો તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાખામાં જ છે. ઉપર જાણોરવાળા નં. ૩૫૪ આદિ લેખામાં જણ્ણાવેલો સા. જયમદલજી અને આ મંત્રી જયમદલજીને એક જ છે.

(૩૬૮)

આ લેખ પણ ઉક્ત મંદિરમાંજ આવેલી એક પ્રતિમા ઉપર લખેલો મળી આવ્યો છે. ભાવાર્થ:—

સં. ૧૪૮૫ ના વૈશાખ શુદ્ધ ઉ બુધવારના દિવસે પ્રાજ્ઞાટ (પોરવાડ) જાતિના હોસી મુલાનામના આવકે પોતાના પિતા હો. મહિપાના શ્રેયાર્થે સુવિધિનાથનું આ બિંઘ કરાંયું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સોમસુંદરસૂરિએ કરી.

(૩૬૯)

આ લેખની હુકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે :—

દેસુરીથી ધર્શાન કોણમાં ૧૫ માઈલ દૂર આવેલા કોટ સોલંકીયા નામના ગામમાંથી આ લેખ હુસ્તગત થયો છે. જીર્ણ થઈ ગયેલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કોતરેલો છે. જેધપુરના સુન્સદે સુન્સી દેવીપ્રસાદે આપેલી એ અદૃતિઓ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યો છે.

આ લેખ આડ પાંકિતનો છે અને ૧૧" પણોળો ૫૯" લાંબો છે. લિપિ નાગરી છે અને લાખા સંસ્કૃત છે. તથા છેલ્લા એક પદ સિવાય આદે લેખ ગયમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે આચન્દ્રક (પં. ૬) માં ર. પછીનો વ્યંજન ઐવડાએલો છે.

૧. એપિગ્રાફિયા. કુનિડકા. પૃ. ૧૧, પૃ. ૬૨.

આ લેખની મિતિ ‘ ૧૯૬૪ ચૈત્ર શુદ્ધ ૧૩ શુક્રવાર ’ છે. અને તે મહારાજાધિરાજ શ્રીવણ્ણવીર હેવના રાજ્ય વખતે લખેલો છે. આગળ જણાવવામાં આવ્યું છે કે આસલપુરમાં આવેલા પાર્થનાથ-હેવના મંદિરની ધ્વના અધારવાના વખતે, રાઉત માદહણુના વંશમાં ઉત્પન્ન થએલા રાઉત સેમાના પોત્ર અને રાઉત બાંધી અને તેની સ્ત્રી જાખતહેવિના પુત્ર રાઉત મૂલરાજે, રાઉત બાલા, રાઉતહુથા તથા કુમર લૂંલા અને નીણાની સમક્ષ, પોતાના માતાપિતાના પુણ્યથોર્યે વાડી સહૃત એક ટિકુઆડ બક્ષીસ કર્યું.

ટિકુઆડ અરહદુ વાળા કુવાને કહેવામાં આવે છે. કોટસોલાંકિ-આના એક બીજા લેખમાં પણ આસલપુરતું નામ આપેલું છે તેથી જણાય છે કે તે આ સ્થળતું પુરાતન નામ હુશે.

(૩૭૦)

આ લેખ પણ ઉપર્યુક્ત મંદિરમાંથીજ મળી આવ્યો છે. શ્રી લાંડારકદે પોતાના હુથની લખેલી જે નકલ મને મોકલી આપી હતી તેના ઉપરથી આ છપાવવામાં આવ્યો છે. લેખોકત હુકીકત આ પ્રમાણે છે:—

સ'. ૧૪૭૫ ના આધાઠ સુહિ ૩ અને સોમવારના દ્વિસે આસલપુર કિલ્વામાંના પાર્થનાથના મંદિરના બાલાણું ૧મંડપને લુણુદ્વાર, ઉપકેશવંશના લિગાગોત્રવાળા.....એ પોતાના આત્માના પુણ્યથોર્યે કરાવ્યો. આ કાર્યમાં સકળ સંઘ અને માંદણું ડાકુર સાક્ષીભૂત છે. આ વખતે રાણું લાલા (ખા) રાજ્ય કરતો હતો અને ડાકુર માંદણું પ્રધાનપણું કરતો હતો.

લેખમાં, ઉદ્વારકરતાએ પોતાની વંશાવળી અને કુટુંબના મનુષ્યો નાં નામો આપ્યાં છે પરંતુ કર્તૃકારક સૂચક વિભાગિતને પ્રત્યય છેવટે

૧ ‘ બાલાણું ’ શબ્દ માટે જુઓ પૃષ્ઠ ૧૦૩ માં ‘ બલાનક ’ શબ્દ ઉપર આપેલી નોંધ. બલાનક એ બાલાણુંજ સંસ્કૃત રૂપ છે.

માત્ર 'સહિત' શાખની સાથે જ નોટેલો હોવાથી આ નામોમાંથી ઉદ્ઘારકર્તા કોણું છે તે નિર્ણય થતું નથી.

(૩૭૧)

આ લેખનું વર્ષનું શ્રી લાંડારકર નીચે પ્રમાણે આપે છે: —

આ લેખ જુના અથવા જુના ખાહુડમેરમાંથી પ્રાપ્ત થયો છે. આ ગામ જેધ્યાર સ્ટેટના મદ્વાળી પ્રાંતમાં આવેલું છે અને મુખ્ય શહેર ખાહુડમેરથી વાયું કોણુંમાં માર માઈલ છેટે છે. ત્યાંના એક જૈન માદ્દિર કે જે હુલમાં લુણું અવસ્થામાં છે તેના દરવાજના એક સ્તંભ ઉપર આ લેખ કોતરેલો છે. તે ૧૦ પંક્તિમાં લખાયેલો છે અને "૧૧૩" પણેણો તથા "૭૩" લાંબો છે. લિપિ નાગરી અને લાગા સંસ્કૃત છે. અંતમાં આપેલા આશીર્વાદમક પદ સિવાય બાળીનો બધો લાગ ગંધમાં આપેલો છે. એમાં વ અને વ ને બદલે એકલો વ જ વાપરેલો છે. ત્રીજી પંક્તિમાં શ્રી શાખની પઢી ર (બેનો અ'ક) મૂકેલો છે કે માત્ર 'શ્રી' શાખનું પુનરાવર્તન (એ વાર વાંચવાનું) સૂચયે છે. અજ્ઞાત શાખદોમાં માત્ર એ છે; એક 'પાઠલા' અને બીજે 'લીમ પ્રિય વિશોપક' (પં. ૭) 'પાઠલા' અને 'વિશોપક' આગળ સમજાવેલા છે અને 'લીમપ્રિય' એ એક વિશોપક શિષ્ણાનું નામ છે. બીજે એક શાખ 'લાગ' (પં. ૮) એ જેને અર્થ 'કરણેરો' થાય છે.

આરંભમાં 'સંવત् ૧૪૫૨ વૈશાખ સુહિ ૪' એ પ્રમાણે મિતિ આપી છે. ઉક્ત દિવસે મહારાજકુલ શ્રી સામંતસિંહદેવના રાજ્ય કારભારમાં જેડાયેસા મંત્રી વીરસેલ, વેલાઉલ, લાંડારી મિગલ વિગેરેએ મળીને ખાહુડમેરમાં આવેલા આદિનાથના દેવાલયમાં સંસ્થિત વિધનમહીન નામના શેત્રપાત તથા ચાઉડ (ચામુંડ ?) નામના દેવરાજને લક્ષ્મિ પૂર્વક એક લેટ કરી. આ લેટમાં, દસ ઉટ અને ૨૦ ખળદો (માલથી ભરેલા) તું જે ટોળું ખડુરગામ જય અથવા ત્યાંથી આવે તેની

૨. એપિગ્રાફિયા ખનિકા પુ. ૧૨, પૃષ્ઠ ૫૮.

પાસેથી એક ‘પાઈલા’ કર રૂપે લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ‘પાઈલા’ ન આપે તો તેના ખફલે દસ ભીમપ્રિય વિશોપક લેવા. આ લેટ ઉકત બંને હેવોને સરણે લાગે વહેંચી હેવી એટલે સમાન લાગે તેનો બંને હેવોની પૂજન યાદિ માટે ઉપયોગ કરવો. આ ‘લાગો’ એટલે કર ગામના મહાજનો (વ્યાપારિઓ) એ સ્વીકાર કર્યો હતો.

આ લેખમાં જણાવેલું ‘બાહુડેઝ’ તે ‘બાડમેર’ જ છે પરંતુ હાલમાં બાડમેરના નામથી જે સ્થળ પ્રખ્યાત છે તે નહિ; કારણ કે તે નવીન વસેલું છે. પુરાતન બાડમેર તો તે જ છે કે જ્યાંથી આ લેખ મળી આવ્યો છે.

(૩૭૨)

આ લેખ, શ્રીચુત લાંડારકરની નોટ ઉપરથી લેવામાં આવ્યો છે. એનું સ્થાન નોટ ઉપર લાખેલું ન હોવાથી જાણી શકાયું નથી.

સં. ૧૫૦૮ ના વૈ. વ. ૧૩ ના દિવસે પ્રાણવાટ જ્ઞાતિના કોઈસં. સાડુલે ચતુવિંશતિ પ્રતિમાઓ કરાવતાં આ શીતલ નાથની પ્રતિમા કે જૈના ઉપર પ્રસ્તુત લેખ કોતરેલો છે તે પણ તેણે કરાવી (?). તેની પ્રતિષ્ઠા, તપાગચ્છના આચાર્ય સોમસુંદરસ્થુરિના પદ્ધદર રત્નશેખર-સૂરિએ કરી. લેખના પાછળના લાગમાં શાનુંજ્ય, દેવકુલપાટક નગર, અર્ધુંદગિરિ, ચંપકમેરુ, ચિત્રકૂટ, જાઉરનગર, કાયદ, નાગહૃદ, એસવાલ, નાગપુર, કુંભલગઢ, દેવકુલપાટક, અને શ્રીકુંડ....વિગેરે ગામો-સ્થળોનાં નામો આપ્યાં છે અને હરેક નામની અંતે ૨ (બેનો અંક) કરેલો છે. તેનો શો હેતુ છે તે બરાબર સ્પષ્ટ થતો નથી. કદાચ એમ અનુમાન કરી શકાય કે તેણે આવી અનેક પ્રતિમાઓ કરાવી હુશે જેમાંની બધી ઉદ્વિઘિત સ્થળે મોકલવામાં આવી હુશે.

ચતુવિંશતિ પ્રતિમા તેને કંઠે છે કે જે એકજ પાણુમાં ચીવીસે તીર્થીંકરની મૂર્તિએ કોતરી કાઢેકી હોય. ધાતુની બનાવેલી આવી

મૂર્તિએ તો પ્રાયઃ દરેક સાધારણ જૈનમંહિરમાંથી મળી આવે છે કેને લોકો ‘ચોવિસી’ કહે છે.

(૩૭૩-૭૪)

મારવાડ રાન્ધના જલોર અને બાદી પ્રાંતની સરહુદ ઉપર એક કોરટા નામનું ગામ આવેલું છે. આ ગામ પ્રાચીન કલમાં વધારે આખાદ હુશો એમ ત્યાંના ખાંડેરો વિગેરે જેતાં જણ્ણાય છે. લેખામાં આનું નામ કોરંટક મળી આવે છે. આ ગામના નામ ઉપરથી એક ગંધ પણ જૂના જમાનામાં પ્રસિદ્ધ હતો. એ કોરંટક ગંધનું નામ આ સંગ્રહમાંના આખું વિગેરે ઘણુંક સ્થળોનાં લેખામાં દખિગોચર થાય છે. હાલમાં તો એ ગામ તફન નહાનું સરખું છે. ત્યાં આગળ પણ જૈમંહિરો છે જેમાનું એક ગામમાં છે અને એ ગામ બહાર જગતમાં છે. ગામનું મંહિર શાંતિનાથ તીર્થીકરનું છે. તેના મંદિરમાં આવેલા એ સ્તંભો ઉપર આ બંને નંબણેના લેખો કોતરેલા છે. પ્રથમના લેખમાં જણાવેલું છે કે યશશ્વર ઉપાધ્યાયના શિષ્ય પદ્મચંદ્ર ઉપાધ્યાચે પોતાની માતા સૂરિના શ્રેષ્ઠાર્થે આ સ્તંભ કરાવી આપ્યો. જીને લેખ પણ આવીજ હકીકતવાળો છે. તેમાં કુદુલાચાર્યના શિષ્ય લદ્દારક થૂલબરે પોતાની ચેહુણી નામની માતાના પુણ્યાર્થે આ સ્તંભ કરાવી આપ્યો, એમ ઉલ્લેખ છે.

(૩૭૫-૭૬)

આ એ લેખો, ઉક્ત કોરટા ગામની બહાર આવેલા મંહિરમાંના છે કેને લોકો ઋખલદેવતું મંહિર કહે છે. એ મંહિરની અંદર એ મહાતી પ્રતિમાએ છે જે મના ઉપર આ લેખો કોતરેલા છે. બંનેની મિતિ ‘સંવત् ૧૧૪૩ વૈશાખ સુદિ ૩ બૃહદ્યુપતિ વાર’ ની છે. આ મિતિ સ્વિવાયનો પહેલો લાગ પદ્ય રૂપે છે અને તે એ અનુષ્ટુલ શ્લોકનો બનેલો છે. કોઈ જેહુક નામના શ્રાવકે વીરનાથ—મહાતીર તિર્થીકરની પ્રતિમા કરાવી અને જેની પ્રતિષ્ઠા આજિતહેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ કરી, આટદી હકીકત આ લેખમાં છે.

थीज लेखने धर्मो अरो लाग जतो रहो छे. भिति सिवाय, कर्कटवंश अने शांतिनाथनु भिंभ आ ऐ वाक्ये ९ अवशिष्ट छे.

आ (पहेला) लेखमां जणुवेला आचार्य अजितहेव अने तेमना शिष्य विजयसिंह ते उपर २८६ नं अरवाणा लेख अने अवलोकनमां जणुवेला अजितहेव-विजयसिंह (शुद्ध-शिष्य) अने एकज छे के सिन्न छे ते एक शांकाश्रस्त प्रक्ष थह पड्यु छे. कारणु के उक्त उपरना लेखनी भिति ज्यारे सः १२०६ छे त्यारे आनी ११४३ छे. आ प्रभाषे तो अने क्षेत्रानी वच्चे ६३ वर्ष लेटलो लांगो समय छे के जे एक व्यक्तिने तेटला समय सुधी आचार्यपद उपर अधिष्ठित रहेवा माटे अस' भव ऐवु गण्याय. नाम साम्य उपरथी तो अने क्षेत्रावाणा एकज होय अम विशेष संभवित जण्याय छे. तेथी भारा विचार प्रभाषे आ प्रस्तुत लेखवाणी सात जे ११४३ नी छे ते वाचवामां अथवा तो पछी केतरवामां भूत थह छे अने सः ११८८ के तेनीज आसपासना थीज डोर्ह १० वर्ष पहेलां-पठीनी आ सात होवी जेहये. जूनी जैन लिपिमां ८ अने ४ ने सरभा वाचवा के केतरवानी भांति थवी धार्षी सहज छे. कारणु के अनेना आकारमां लभनाराओनी अमुक वण्णुना लीधे केटलीक वर्षते धार्षीज समता आवी जय छे.

अथवा तो सात भरी होय अने भांति त्यां थह होय के ज्यां आगण 'थीमन्तोडजित' आ वाक्य आवेद्यु छे. कारणु के लेखमां सुचव्या अभाषे तेटला अक्षरो धसाई गया छे तेथी स्पष्ट वाची शक्ता नथी, आ कारणुने लधने अजितहेवना ठेकाषे अलयहेव के ऐवुंज थीजुं डोर्ह नाम पणु होर्ह शके.

आ क्षेत्रा पणु श्री लांडारकरनी नोट उपरथीज उतारवामां आव्या छे.